

Visit of Minister of Foreign Affairs of the Hellenic Republic (Greece) to India (March 22-23, 2022)

March 23, 2022

હેલેનિક રિપબ્લિક (ગ્રીસ)ના વિદેશમંત્રીની ભારતયાત્રા (માર્ચ 22-23, 2022)

માર્ચ 23, 2022

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરના આમંત્રણ પર, ગ્રીસના વિદેશ મંત્રી, મહામહિમ નિકોસ ડૉડિયાસે 22-23 માર્ચ 2022ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હતી.

2. ગ્રીસના વિદેશમંત્રી 23 માર્ચ 2022ના રોજ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો માટે ભારતીય વિદેશમંત્રીને મળ્યા હતા. ગ્રીક પક્ષે ભારતને તેની સ્વતંત્રતાના 75 વર્ષ પર અભિનંદન પાઠવ્યા હતા. વિદેશમંત્રીએ ગ્રીસને સ્વતંત્રતા માટેના તેમના યુદ્ધની શરૂઆતના 200 વર્ષ પૂરા થવા પર અભિનંદન પાઠવ્યા હતા.

3. ભારત અને ગ્રીસ ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે જે લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો પર આધારિત છે. અમારા દ્વિવપક્ષીય સંબંધો સમૃદ્ધ સંસ્કૃતિના જોડાણો દ્વારા ચિહ્નિત થયેલ છે. આ સંબંધો 2018માં ભારતના માનનીય રાષ્ટ્રપતિની ગ્રીસની વારંવારની ઉચ્ચ-સ્તરીય મુલાકાતો, 2017માં ગ્રીક એક્ઝેમની ભારતમાં અને જૂન 2021માં વિદેશમંત્રીની ગ્રીસની મુલાકાત સહિતની વિશેષતા ધરાવે છે.

4. બંને પક્ષોએ દ્વિવપક્ષીય સંબંધોના સમગ્ર સ્તર પર ચર્ચા કરી હતી અને બંને દેશો વચ્ચેના ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર વાતચીત કરી હતી. બંને મંત્રીઓએ આશા વ્યક્ત કરી કે 15 એપ્રિલ 2022ના રોજ એથેન્સ ખાતે યોજનારી સંયુક્ત આર્થિક સમિતિની બેઠકનો 8મો રાઉન્ડ વેપાર અને રોકાણ સંબંધોને વધુ વેગ આપશે. તેઓએ પ્રશંસા કરી કે વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે, રોગચાળા દ્વારા ઊભા કરાયેલા પડકારો છતાં તે 1 અબજ અમેરિકન ડોલરને વટાવી ગયો છે. બંને પક્ષો શિપિંગ અને મેરીટાઈમ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કૃષિ, નવી અને નવીનીકરણીય ઊર્જા અને ફાર્માસ્યુટિકલ્સ જેવા પરસ્પર ફાયદાકારક ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.

5. બંને પક્ષોએ નવી ભૌગોલિક-રાજકીય અને ભૌગોલિક-આર્થિક વાસ્તવિકતાઓના સંદર્ભમાં પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. યુરોપિયન યુનિયન, પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર, અફઘાનિસ્તાન અને યુક્રેનને લગતા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ બહુપક્ષીયવાદ અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પ્રત્યે તેમની ઊંડી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે યુએનના તાકીદના સુધારાના મહત્વની પુનઃ પુષ્ટિ કરી હતી. વિદેશ કાર્યાલય પરામર્શનો આગામી રાઉન્ડ ટૂંક સમયમાં સુનિશ્ચિત કરવામાં આવશે તે અંગે પણ સહમતિ સંધાઈ હતી.

6. બંને પક્ષોએ લોકોની કાયદેસરની આવનજવનના મહત્વ પર ભાર મુક્યો હતો અને માર્ઈગ્રેશન અને મોબિલિટી અંગે ઈરાદાપત્ર પર સહી કરી હતી.
7. પોતાના સમૃદ્ધ પ્રાચીન ભૂતકાળને ધ્યાનમાં રાખીને બંને પક્ષો સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના સંબંધો ચાલુ રાખવા સંમત થયા હતા. મુલાકાત દરમિયાન 2022-2026ના પાંચ વર્ષના સમયગાળા માટે સાંસ્કૃતિક અને શિક્ષણ વિનિમય કાર્યક્રમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
8. ગ્રીસના વિદેશમંત્રીએ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ પરના ફેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરનાર તરીકે ગ્રીસનું ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ રેટિફિકેશન સોંપ્યું હતું.
9. બંને પક્ષોએ વ્યૂહાત્મક ભાગીદારી માટે દ્વિવપક્ષીય સંબંધોને વધારવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી.
10. આ દરમિયાન આપણા મહાસાગરોને મુક્ત અને અવરજવર અને વેપાર માટે ખૂલ્લા રાખવાના મહત્વ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ સમુદ્રના કાયદા (યુએનસીએલઓએસ)ને સમર્થન અને તેનું પાલન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
11. ગ્રીસના વિદેશમંત્રીએ તેમની મુલાકાત દરમિયાન માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈકૈયા નાયડુ સાથે પણ મુલાકાત કરી હતી.
12. ગ્રીસના વિદેશમંત્રીની મુલાકાતે ભારત અને ગ્રીસ વચ્ચેના દ્વિવપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની ગતિને ટકાવી રાખવામાં ક્ષણો આપ્યો છે.

નવી દિલ્હી
માર્ચ 23, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.